

November 1, 2018

E-FILING

To

1. The Manager, Corporate Relationship Dept.,
BSE LIMITED,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
MUMBAI – 400 001

2. The Manager, Listing Department,
NATIONAL STOCK EXCHANGE OF INDIA LTD.,
"Exchange Plaza", C-1, Block-"G",
Bandra-Kurla Complex, Bandra (E),
MUMBAI – 400 051

Script Code : 526725

NSE Symbol : SANDESH (EQ.)

Dear Sir / Madam,

Sub: Intimation to Stock Exchange regarding publication of Financial Results in Newspapers

Pursuant to Regulation 30 and 47(3) read with Schedule III of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed the copies of newspaper advertisement publishing the Extracts of the Standalone Un-Audited Financial Results of the Company for the Quarter and half year ended September 30, 2018 which were considered, approved and taken on record by the Board of Directors, in their meeting held on October 31, 2018. The aforesaid extracts of the financial results are published on November 1, 2018 in the following newspapers:

1. "Financial Express" (English Newspaper) and
2. "Sandesh" (Gujarati Newspaper).

Further, in terms of Regulation 46 of the Listing Regulations, the aforesaid financial results are also uploaded on the website of the Company (www.sandesh.com).

Kindly take the same on your records.

Thanking you,

Yours sincerely,
FOR, THE SANDESH LIMITED


DHAVAL PANDYA
COMPANY SECRETARY



Encl: As Above

THE SANDESH LIMITED (CIN : L22121GJ1943PLC000183)

REGD. OFFICE : SANDESH BHAVAN, LAD SOCIETY ROAD, B/H. VASTRAPUR GAM, P.O. BODAKDEV, AHMEDABAD-380 054.

PHONE : (079) 40004319, 40004175, FAX NO. : 91-079-40004242 E-mail : secretarial@sandesh.com, cs@sandesh.com

VISIT US : WWW.SANDESH.COM

PUSHPANJALI FLORICULTURE LIMITED

A-26, 4th Floor, Ajanta Commercial Center,
Nr. Income Tax Circle, Opp. Kalapur Bank,
Ashram Rd Ahmedabad GJ 380014.
CIN: L51100GJ1995PLC027519
Email Id: pushpanjalid@gmail.com
Website: www.pushpanjalifloriculture.com
Phone No. 079-27541150

NOTICE OF BOARD MEETING

Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (Listing Regulations), Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Tuesday, November 13, 2018, inter alia, to consider and approve the Un-audited Financial Results along with Limited Review Report for the Quarter ended and Half year ended on September 30, 2018.

The said Notice may be accessed on the Company's website at <http://www.pushpanjalifloriculture.com> and may also be accessed on the Stock Exchange website at <http://www.bseindia.com>.

Pursuant to this, the Company has decided that the close period (i.e. closure of trading window) as per the Company Code of Conduct for Prevention of Insider Trading read with Securities and Exchange Board of India (Prohibition of Insider Trading) Regulations, 2015 would commence from November 01, 2018 and end 48 hours after the results are made public on November 13, 2018.

For Pushpanjali Floriculture Limited
Sd/-
Place: Ahmedabad Virchand Lalka
Date: 31/10/2018 Managing Director

KUBER UDYOG LIMITED

G/C-1, Ground Floor, Trupti Apartment, B/H. Old High Court, Navrangpura, Ahmedabad - 380009
CIN: L51909GJ1982PLC100824
Email Id: kuberudyoglimited@gmail.com
Website: www.kuberudyog.com
Phone No. 079-27543650

NOTICE OF BOARD MEETING

Pursuant to Regulation 29 read with Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (Listing Regulations), Notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on Tuesday, November 13, 2018, inter alia, to consider and approve the Un-audited Financial Results along with Limited Review Report for the Quarter ended and Half year ended on September 30, 2018.

The said Notice may be accessed on the Company's website at <http://www.kuberudyog.com> and may also be accessed on the Stock Exchange website at <http://www.bseindia.com>.

Pursuant to this, the Company has decided that the close period (i.e. closure of trading window) as per the Company Code of Conduct for Prevention of Insider Trading read with Securities and Exchange Board of India (Prohibition of Insider Trading) Regulations, 2015 would commence from November 01, 2018 and end 48 hours after the results are made public on November 13, 2018.

For KUBER UDYOG LIMITED
Sd/-
Place: Ahmedabad Chetan Shinde
Date: 01/11/2018 Managing Director

**LKP SECURITIES LIMITED**

CIN: L67120MH1994PLC080039

REGD. OFF. 203, EMBASSY CENTRE NARIMAN POINT, MUMBAI-400 021

Tel: 91-22-40024785 / 86 Fax: 91-22-22874787

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 SEPTEMBER, 2018

(Rs. in lacs except per share data)

Sr. No.	Particulars	STANDALONE		
		Quarter Ended	Half Year Ended	Quarter Ended
		(Unaudited) 30-Sep-2018	(Unaudited) 30-Sep-2018	(Unaudited) 30-Sep-2017
1	Total Income from operations (net)	2,024.95	4,034.53	2,032.01
2	Net Profit / (Loss) from ordinary activities after tax	(46.32)	(121.72)	270.61
3	Net Profit / (Loss) after Extraordinary items	(46.32)	(121.72)	270.61
4	Paid-up Equity Share Capital	1,464.43	1,464.43	1,464.43
	Face Value of the Shares	2.00	2.00	2.00
5	Reserves excluding revaluation reserves as per balance sheet	-	2,026.04	-
6	Earning Per Share (EPS) (Face value of Rs.2)			
	-Basic	(0.06)	(0.17)	0.37
	-Diluted	(0.06)	(0.16)	0.37

Note :

1 The above is an extract of the detailed format of Quarter ended 30th September, 2018 Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarter ended 30th September, 2018 Financial Results are available on the website the Stock Exchange on which share of the Company are listed, namely www.bseindia.com and also available on Company's website which shares www.lkpsec.com

For LKP SECURITIES LTD
Sd/-
Pratik M. Doshi
Managing Director

Mumbai
Date: 30 October 2018

SJ CORPORATION LIMITED

CIN: L51900MH1981PLC025223

Corp. Office: 201, Shyam Bunglow, 199/200, Pushpa Colony, Manchubhai Road, Malad (E), Mumbai - 97.

Email Id : sjcorporation9@yahoo.com Tel No.: 022-28449521 Website: www.sjcorp.in

Extract of Standalone Unaudited Financial Results for the Quarter/ Half Year ended 30th September, 2018


Sr. No.	Particulars	Quarter Ended			Half Year Ended		
		30-09-2018	30-06-2018	30-09-2017	30-09-2018	30-09-2017	31-03-2018
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total income from operations (net)	258.32	293.09	(2.94)	551.41	484.04	825.26
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	29.07	0.43	(12.90)	29.50	(18.93)	(16.51)
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional items)	29.07	0.43	(12.90)	29.50	(18.93)	(16.51)
4	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional items)	25.26	0.13	(12.90)	25.39	(18.93)	(1.64)
5	Total comprehensive income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	8.58	0.11	(16.54)	8.69	(39.63)	(10.92)
6	Paid up Share Capital (FV of Rs. 1/- each fully paid up)	83.55	83.55	83.55	83.55	83.55	83.55
7	Other Equity	-	-	-	-	-	772.27
8	Earnings per equity share (for discontinued & continuing operations)						
	1. Basic	0.302	0.002	(0.154)	0.304	(0.227)	(0.020)
	2. Diluted	0.302	0.002	(0.154)	0.304	(0.227)	(0.020)

Notes :

- This statement has been prepared in accordance with Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under section 133 of the Companies Act, 2013 and other recognised accounting practices and policies to the extent applicable.
- The above unaudited financial results for the quarter and six month ended on September 30, 2018 were reviewed by audit committee and approved by the board of Directors at the meeting of the Board of Directors held on 31st October, 2018. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the aforesaid results.
- Effective April 1, 2018, the Company has adopted Ind AS 115 using the cumulative effect method. The standard is applied retrospectively only to contracts that are not completed as at the date of Initial application and the comparative information is not restated in the condensed consolidated interim statement of profit and loss. The adoption of the standard did not have any significant impact to the financial statements of the Company.
- Figures of the corresponding previous period have been regrouped, rearranged wherever necessary to conform to the classification or the current period.
- The Company has only one reportable segment.

By order of the Board
For SJ Corporation Limited
Deepak B. Upadhyay
Managing Director (DIN:02270389)

Place : Mumbai
Date : October 31, 2018

**Strides Pharma Science Limited**

(Formerly Strides Shasun Limited)

CIN : L24230MH1990PLC057062

Registered Office: 201, 'Devavrata', Sector 17, Vashi, Navi Mumbai - 400 703

Tel No.: +91 22 2789 2924; Fax No.: +91 22 2789 2942

Corporate Office: 'Strides House', Bilekahalli, Bannerghatta Road, Bengaluru - 560 076

Tel No.: +91 80 6784 0000/ 6784 0290; Fax No.: +91 80 6784 0700

Website: www.strides.com; Email ID: investors@strides.com**Extract of the Consolidated Unaudited Financial Results for the Quarter and Half Year ended September 30, 2018**

Rs. In Lakhs

Particulars	Consolidated					
	3 Months ended 30.09.2018	Preceding 3 Months ended 30.06.2018	Corresponding 3 Months ended in the previous year 30.09.2017	Year to date figures for the current period ended 30.09.2018	Year to date figures for the previous period ended 30.09.2017	Previous year ended 31.03.2018
	UNAUDITED	UNAUDITED**	UNAUDITED**	UNAUDITED	UNAUDITED**	AUDITED**
Continuing operations						
Revenue from operations	73,263	66,346	76,866	139,609	142,644	283,938
Net Profit from ordinary activities before Exceptional Items and tax (*)	1,436	443	4,409	1,879	6,290	14,033
Net Profit / (Loss) from ordinary activities before tax	(533)	(842)	2,654	(1,375)	3,893	7,995
Net Profit / (Loss) from ordinary activities after tax from continuing operations	(694)	(255)	2,112	(949)	3,027	7,427
Profit/(loss) after tax from discontinued operations	(176)	(1)	(939)	(177)	(1,176)	61,012
Total comprehensive income for the period	407	(2,483)	1,519	(2,076)	3,106	66,838
Equity share capital	8,955	8,955	8,949	8,955	8,949	8,950
Other equity				227,507	263,509	237,412
Earnings per equity share (for total operations) (face value of Rs. 10/- each) - not annualised						
(a) Basic EPS (Rs.)	(1.34)	(0.48)	0.96	(1.82)	1.14	74.25
(b) Diluted EPS (Rs.)	(1.34)	(0.48)	0.96	(1.82)	1.14	74.23

(*) The Company did not have Extra-ordinary items for the given periods.

(**) Restated

Note:

1) The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Stock Exchange websites viz., www.nseindia.com & www.bseindia.com and on the Company's website www.strides.com.

For and on behalf of the Board
Sd/-
Arun Kumar
Group CEO & Managing Director

Bengaluru, October 31, 2018

THE SANDESH LIMITED

REGD. OFFICE : "SANDESH BHAVAN", LAD SOCIETY ROAD, B/H. VASTRAPUR GAM, P.O. BODAKDEV, AHMEDABAD - 380 054.(GUJ.) | (CIN - L22121GJ1943PLC000183)

**EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2018**

(Rs. In Lacs, except earning per share data)

Sr. No.	PARTICULARS	QUARTER ENDED		Half Year Ended
		September 30, 2018	September 30, 2017	September 30, 2018
		UNAUDITED	UNAUDITED	UNAUDITED
1.	Total Income from Operations	8965.55	9188.53	21068.86
2.	Net Profit for the period before Tax, Exceptional items	1651.23	3305.37	4301.62
3.	Net Profit for the period before Tax after Exceptional items	1650.93	3306.53	4301.42
4.	Net Profit for the period after tax & Exceptional items	1099.70	2251.47	2819.27
5.	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1099.70	2251.47	2819.27
6.	Paid-up Equity Share Capital	756.94	756.94	756.94
7.	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance sheet of previous financial year)	-	-	-
8.	Earnings Per Share (of Rs.10/- each) (Not Annualised)			
	Basic	14.53	29.74	37.25
	Diluted	14.53	29.74	37.25


Note :

(i) The above is an extract of the detailed format of Standalone Unaudited Financial Results for the Quarter and Half Year ended September 30, 2018, filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the aforesaid Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com & www.nseindia.com) and Company's website (www.sandesh.com).

For and on behalf of the Board
The Sandesh Limited

Place: Ahmedabad
Date : October 31, 2018

Parthiv F. Patel
(DIN: 00050211)
Managing Director



EMAIL: INVESTORS@SANDESH.COM, CONTACT NO. (079) 4000 4000, 4000 4319, FAX NO. (079) 4000 4242, WEBSITE: WWW.SANDESH.COM

FILATEX INDIA LIMITEDRegd Office: S.No.274, Demni Road, Dadra-396 193 (U.T. of Dadra & Nagar Haveli)
Corporate Identification Number (CIN)-L17119DN1990PLC000091**Extract of Statement of Standalone Unaudited Financial Results for the Quarter and Half year ended September 30, 2018**

(Rs. In Lakhs)

S. No.	PARTICULARS	Standalone				Year ended 31.03.2018 (Audited)
		Quarter Ended		Half Year ended		
		30.09.2018 (Unaudited)	30.09.2017 (Unaudited)	30.09.2018 (Unaudited)	30.09.2017 (Unaudited)	
1	Total income from operations (refer note no. d)	71,833	41,443	142,254	89,157	197,445
2	Net Profit for the period (before tax, exceptional and/or extraordinary items)	2,843	2,057	5,944	4,259	9,272
3	Net Profit for the period before tax (after exceptional and/or extraordinary items)	3,077	2,057	6,178	4,259	9,272
4	Net Profit for the period after tax (after exceptional and/or extraordinary items)	2,025	1,352	4,039	2,785	5,978
5	Total Comprehensive Income for the period [Comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	2,034	1,353	4,057	2,786	6,009
6	Paid up Equity Share Capital (Face value of Rs. 2/- each)	4,350	4,350	4,350	4,350	4,350
7	Earnings Per Share (Face value of Rs. 2/- each) (Not Annualised) (refer note c) below					
	Basic :	0.93	0.62	1.86	1.28	2.75
	Diluted :	0.92	0.62	1.83	1.28	2.71

Notes:

- The above is an extract of the detailed format of standalone results for Quarter and Half year ended on September 30, 2018 filed with the stock exchanges under regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone Quarterly/ Yearly financial results are available on Company's Websites www.filatex.com and on the website of the Stock Exchanges www.nseindia.com and www.bseindia.com.
- The above results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors at their meeting held on October 31, 2018 and had undergone a "Limited Review" by the Statutory Auditor of the Company. The standalone financial results have been prepared in accordance with Indian Accounting Standards (IND-AS) as prescribed under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 and relevant amendment rules thereafter.
- The shareholders of the Company at their Extra Ordinary General Meeting held on June 15, 2018 approved the sub-division of One equity share of face value of Rs. 10 per share into five equity shares of face value of Rs. 2 per share. Consequently, in accordance with Indian Accounting Standard (Ind AS) 33 - "Earning per share" the basic and diluted earnings per share of the previous periods have been retrospectively adjusted for comparative purpose.
- In accordance with the requirements of IndAS, revenue for the quarter ended September 30, 2018 and September 30, 2017 and Half year ended September 30, 2018 are net of Goods & Services Tax (GST). However, revenue for the Half year ended September 30, 2017 and Year ended March 31, 2018 are inclusive of excise duty amounting to Rs. 4.686 lakhs.

On behalf of the Board of Directors

MADHU SUDHAN BHAGERIA
CHAIRMAN & MANAGING DIRECTOR
DIN NO. 00021934

Place : New Delhi
Date : October 31, 2018

VENUS INDIA ASSET-FINANCE PRIVATE LIMITEDRegd. Office : 198/12-13, 2nd Floor, Ramesh Market, East of Kailash, New Delhi - 110065
CIN No. U65921DL1996PTC081630**STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE YEAR TO DATE/ PERIOD ENDED SEPTEMBER 30, 2018**

S. No.	Particulars	6 months ended 30 September, 2018	Corresponding 6 months ended in the previous year 30 September, 2017	Year to date figures for current Period ended 30 September, 2018	Previous accounting year ended 31 March, 2018
		Unaudited	Unaudited	Unaudited	Unaudited
		Rs.	Rs.	Rs.	Rs.
Revenue from operations					
1	Income from loans and advances	249,476,333	177,822,184	249,476,333	388,886,362
2	Other income	-	640,529	-	640,529
3	Total revenue (1+2)	249,476,333	178,462,713	249,476,333	389,526,891
Expenses					
	Employee benefits expense	17,087,816	14,189,192	17,087,816	42,428,172
	Finance costs	70,562,084	23,171,885	70,562,084	65,918,571
	Depreciation expense	1,654,463	1,870,304	1,654,463	4,147,374
	Other expenses	24,738,613	28,974,440	24,738,613	46,986,330
	Total expenses	114,042,976	68,205,821	114,042,976	159,480,447
5	Profit before tax (3-4)	135,433,357	109,256,892	135,433,357	230,046,444
Tax expense					
	Current tax	39,532,100	33,272,900	39,532,100	67,640,400